

AMRAPALI INDUSTRIES LTD.

Date: September 09, 2021

To,
BSE Limited
Phiroze Jeejeebhoy Towers,
Dalal Street,
Mumbai - 400001.

Respected Sir/Ma'am

Sub-Newspaper Advertisement of 33rd Annual General Meeting of the Members of Amrapali Industries Limited. Ref: Amrapali Industries Limited (Security Code/Security Id: 526241/AMRAPLIN)

With reference to caption subject, we would like to inform you that the Notice of 33rd Annual General Meeting (AGM) was published on Tuesday September 07, 2021 in "Western Times" in English Newspaper and in "Western Times" Gujarati Newspaper.

Further, Pursuant to Regulation 30 of SEBI (Listing Obligation and Disclosure requirement) Regulations, 2015 and Schedule III, Kindly note that the Company has completed the process of issuing notice of AGM to the members along with Annual Report For the Financial year 2020-21 and instruction for e-voting & attaining AGM through VC/OAVM on 06th September 2021.

Please find enclosed herewith the copy of Newspaper advertisement of the Annual General Meeting and instruction for e-voting VC/OAVM.

Please take the same on your record.

For, Amrapali Industries Limited

721019 8884

Yashwant Thakkar Chairman & Managing Director DIN: 00071126

Place: Ahmedabad

Encl:a/a



Regd. Office: Unit No. PO5-02D, 5th Floor, Tower A, WTC Gift City, Gandhinagar-382355, (Gujarat.)

E-mail: ail@amrapali.com / www.amrapalispot.com

Correspondence/Corporate Office :

19-20-21, Narayan Chambers, 3rd Floor, B/h. Patang Hotel, Ashram Road, Ahmedabad-9. CIN: L91110GJ1988PLC010674

T+91 79 26581329/30 T+91 79 26575105/06 F+91 79 26579169/26584313

AND In the matter of

EMTICI ENGINEERING LIMITED AKAAISH MECHATRONICS LIMITED WIZARD FINCAP LIMITED SPECIALITY WOOD PACK PRIVATE LIMITED PRAYAS ENGINEERING LIMITED

.. Applicant No.5 **ELECON INFORMATION TECHNOLOGY LIMITED** .. Applicant No.6 **ELECON PERIPHERALS LIMITED** .. Applicant No.7 **DEVKISHAN INVESTMENTS PRIVATE LIMITED** .. Applicant No.8 BIPRA INVESTMENTS AND TRUSTS PRIVATE LIMITED .. Applicant No.9

AAKAAISH INVESTMENTS PRIVATE LIMITED .. Applicant No.10 Applicant Nos. 1, 2, 3, 4, 5, 6, 7, 8 and 9 having Registered Office at: Anand-Sojitra Road, Vallabh Vidhyanagar, Anand - 388120 Gujarat and Applicant No. 10 having registered office at Honest House, Bakrol Road, Vallabh Vidhyanagar, Anand - 388120.

Notice of Meetings of Unsecured Creditors of Applicant Nos. 1, 4, 5, 6 & 7 and Meetings of Secured Creditors of the Applicant Nos. 1, 5 & 7

Notice is hereby given that by order dated 31.08.2021 passed in CA(CAA) No. 50/2021 by Hon'ble NCLT, Ahmedabad Bench has directed for convening the following meetings:

Sr.	Name of Company	Type of Meeting	Day, Date, Time of Meeting	Mode of Meeting
1.	Emtici Engineering Ltd	Secured Creditors	8.10.2021 Friday at 10.30 am	Physical
2.	Prayas Engineering Ltd	Secured Creditors	8.10.2021 Friday at 11.30 am	Physical
3.	Elecon Peripherals Ltd	Secured Creditors	8.10.2021 Friday at 12.30 pm	Physical
4.	Emtici Engineering Ltd	Unsecured Creditors	8.10.2021 Friday at 5.00 pm	Video Conference
5.	Speciality Wood Pack Pvt Ltd	Unsecured Creditors	9.10.2021 Saturday at 11.00 am	Video Conference
6.	Prayas Engineering Ltd	Unsecured Creditors	9.10.2021 Saturday at 1.00 pm	Video Conference
7.	Elecon Information Technology Ltd	Unsecured Creditors	8.10.2021 Friday at 2.00 pm	Physical
8.	Elecon Peripherals Ltd	Unsecured Creditors	9.10.2021 Saturday at 4.00 pm	Video Conference

For the purpose of considering and if thought fit with or without modification the composite scheme of MERGER & ARRANGEMENT BETWEEN EMTICI ENGINEERING LIMITED ("First Demerged Company") AND AKAAISH MECHATRONICS LIMITED ("Second Demerged Company") AND WIZARD FINCAP LIMITED ("Third Demerged Company") AND SPECIALITY WOOD PACK PRIVATE LIMITED ("Fourth Demerged Company") AND PRAYAS ENGINEERING LIMITED ("Fifth Demerged Company") AND ELECON INFORMATION TECHNOLOGY LIMITED ("Sixth Demerged Company") AND ELECON PERIPHERALS LIMITED ("Seventh Demerged Company") AND DEVKISHAN INVESTMENTS PRIVATE LIMITED ("First Transferor Company") AND BIPRA INVESTMENTS AND TRUSTS PRIVATE LIMITED ("Second Transferor Company") AND AAKAAISH INVESTMENTS PRIVATE LIMITED ("Transferee Company" or " Resulting Company") THEIR RESPECTIVE SHAREHOLDERS UNDER SECTION 230 TO 232 AND OTHER APPLICABLE PROVISONS OF THE COMPANIES ACT, 2013

In pursuance of the circulars of Ministry of Corporate Affairs, through video Conferencing or Other Audio Visual Means (VC/OAVM) in respect of concerned meetings of the respective applicants as stated above.

Copy of the said scheme and statement u/s. 230 and guidelines to join the meeting through VC/OAVM can be obtained free of charge from the respective registered office.

In view of the meetings of unsecured creditors of Applicant Nos. 1, 4, 5 & 7 being convened through VC/OAVM, proxies are not allowed to attend or vote at the meetings.

As far the meetings of the unsecured creditors of the Applicant No.6 and meetings of the secured creditors of the Applicant Nos. 1, 5 & 7 being convened physically at the registered office, the proxies are allowed provided the proxy is deposited 48 hours before the meeting.

The Hon'ble NCLT Ahmedabad Bench appointed Shri Krishnarai Jhala CA to act as the Chairman of all the meetings and Shri Dineshkumar Govindbhai Bhimani, PCS to act as the Scrutinizer of all the meetings.

The Scheme, if approved in the meeting, will be subject to the subsequent approval/sanction of the Hon'ble NCLT.

FURTHER NOTICE is hereby given to the Unsecured Creditors of the Applicant Nos. 1, 4, 5, 6 & 7 and to the Secured Creditors of the Applicant Nos. 1.5 & 7 that:

1. The voting right of the respective unsecured creditors and secured creditors shall be in proportion to the value of debt.

2. The respective Applicant Companies sending through email of the respective unsecured and secured creditors whose email is available and through speed post/courier the notice of the Hon'ble NCLT

3. In respect of the meetings as shall be conducted through VC/OAVM, the remote e-voting shall commence for the unsecured creditors meeting of Applicant No.1 on Tuesday, 5th October, 2021 at 10.00 am and will end on Thursday, 7th October, 2021 at 5.00 pm and in respect of meetings of unsecured creditors of the Applicant Nos. 4, 5 & 7, the remote e-voting shall commence on Wednesday, 6th October, 2021 at 10.00 am and will end on Friday, 8th October, 2021 at 5.00 pm. During the voting period, the respective unsecured creditors of the Applicant Nos. 1, 4, 5 & 7 as on the cut-off date may cast their vote through remote e-voting. The remote e-voting will not be allowed beyond 5.00 pm IST as aforesaid. The remote e-voting module shall be disabled by NSDL/CDMSL for voting thereafter.

Date: 06.09.2021

TENDER NOTICE NO.04, OF 2021-22

(Tend I.D.No.480580 Third Attempt)

D.W.S.U (Wasmo) Gandhinagar

D.W.S.U (Wasmo) Gandhinagar

Unit Manager, District Water and Sanitation Unit, WASMO, Gandhinagar Gujarat State invites online tenders on behalf of Vihar Village pani samittee for below mentioned work.

1.Name of Work:- Providing, supllying & lowering, laying and jointing different dia of pvc pipe, work for village: Vihar, Ta:Manasa Under Jal Jivan mission Scheme, Dist.Gandhinagar.

2. Total Estimated Cost:- 7.35 lakh

3. Last date of submission of tender:- up to 20/09/2021 18.00 Hrs.

4. Last date of physical documents submission of tender:- 21/09/2021 up to 18.00 Hrs.

5. Elegiblety:- The tender is in One bid system, the bidders who are registered(Civil) in "R&B or Irrigation Dept.in Appropriate class" with tender bidders have to attech. Copy of Registeation. GST Registration, Pan Card, Blacklist/Debarred details (form-09) On Rs.300/- non judicial stamp. Form-18 on Letterhead, Is compulsary. Rates must include GST if applicable. Hard copy of tender will accept by R.P.A.D/Speed Post/ Hand to Hand only. Further information is available at web site www.nprocure.com
Control Room is functioning at the state level for rural level water supply schemes Where toll free number 1916 can be contacted for water related complaints/ suggestions.

INF/1033/21-22



.. Applicant No.1

.. Applicant No.2

.. Applicant No.3

.. Applicant No.4

GUJARAT WATER SUPPLY AND SEWERAGE BOARD "for complaints regarding rural drinking water supply, please contact toll-free helpline No.1916 of GWSSB"

Tender Notice No. 08/2021-2022

Superintending Engineer, Public Health Works Circle, 1ST Floor, Sardai Vallabhbhai Patel Shopping Centre, Sardarnagar Circle, Bhavnagar Phone No.(0278) 2565082 Fax, No.2565013 invites tender for (1) Desigr nd construction of RCC Sump, Gravity and pumping pipeline, pumping machinaries for village level storage under Bagasara Group Ta.Bagasara/Amreli District: Amreli estimated cost Rs.2,11,45,339.00 Tender I.D.No.477441 (2) Design and construction of RCC sump, Gravity and pumping pipeline, pumping machinaries for Village Level Storag Under Lathi-Liliya-Chavand Regional WSS Ta.Lathi/Liliya/Babara District: Amreli estimated cost Rs.3,33,07,866.00 Tender I.D.No.477442 (3) Design and construction of RCC sump, Gravity and pumping pipeline pumping machinaries for village Level Storage Under Savarkundla Group Ta.Savarkundla District:Amreli estimated cost Rs.4,77,09,115.00 Tendel ID.No.477443 (4) Design and construction of RCC sump, Gravity and pumping pipeline, pumping machinaries for Village Level Storage Under Ishwariya Group Ta.Amreli/Lathi/Liliya District: Amreli estimated cost Rs.3,47,10,435.00 Tender I.D.No.477444 by E.Tendering Online tender with Singale Bid System from Registered contractors for above mentior works. The detail information are available on website https:// gwssb.nprocure.com Last Date for Online Submission Dt.06-10-2021 till 18.00 Hours Any further changes/amendments here after shall be published online only.

DDI-BVN-443/21-22

CHANGE OF NAME

have changed my old name rom PATEL PRAVINKUMAR **RAMBHAI** to new name PATEL PRAVINBHAI **RAMBHAI**

Add.: 7, Chandroday Society Bhaupura, At & Ta. Kadi, Dist. Mehsana

Change of Name

I RANJENDRAKUMAR MADHAVLAL PATEL CHANGED My son name from NACHIKETKUMAR RAJENDRAKUMAR PATEL to new name NACHIKET RAJENDRAKUMAR PATEL Add:6 -TRIBHOVAN PARK, VISNAGAR. MEHESAN.

CHANGE OF NAME

I have changed my old name from **PATEL KAMUBEN GHANSHYAMBHAI** to new name PATEL KAMLABEN **GHANSHYAMBHAI** Add.: 5, Shreedhar Palace,

Pdpu Road, Nr. Gift Villa, Raysan Gandhinagar-382007

/ESTERN RAILWAY-VADODARA DIVISIOI ENGINEERING DEPARTMENT e-TENDER NOTICE NO.

DRM-BRC 079 OF 2021-2022 ealed Tenders for and on behalf of the resident of India are invited by Divisiona Railway Manager (WA/C) Western for the following work:- Sr. No.:1. Tender No. & Name of Work: DRM BRC 079 of 2021-22. Vadodara Division:- Civi eering works including Electrical (P works and other associate works in connection with replacement of indoor and outdoor signalling works at Nabipur and Kanii station and CSI store at Nadiao station, AFTC by MSDAC works for storage of S&T cable at Anand and Nadiac station and new Duty Bunk at LC No. 275 & 295 in connection with shifting of S& equipment. Approximate cost of the work (in Rs.): 6,49,76,606.07 Earnest money to be deposited (in Rs.): As per bid Security declaration. **Date and time for** submission of tender and opening of tender: Tender is to be submitted on 01 10 2021 before 15 00 Hrs. and is to be pened on same date at 15.30 Hrs Website particulars and notice for location where complete details can be seen & Address of the office from where the tender form can be purchased Website @ www.ireps.gov.in Divisiona Railway Manager (WA/C)Western Railway Pratapnagar, Vadodara-4. W/623/NIT of 2021-22 dated 03 09 2021 BRC-119 Follow us: www.twitter.com/WesternRly

Krishnaraj Jhala (Chairman)

Indo Us Bio-Tech Limited

(CIN: L01122GJ2004PLC043550)

Regd. Office: 309, Shanti Mall, Satadhar Char Rasta, Opp. Navrang Tower,

Šola Road, Ahmedabad – 380061, Gujarat Phone No.: 079 27491807

Email ID: indouscs@gmail.com Website: https://www.indousagriseeds.com/

Notice to the Shareholders of 17th Annual General Meeting

NOTICE IS HEREBY GIVEN THAT THE 17th ANNUAL GENERAL MEETING (AGM) of the

members of the Company will be held on Wednesday, 29th September, 2021 at 11:00 AM through Video Conferencing ("VC")/Other Audio-Visual Means ("OAVM") to transact the businesses as set out in the Notice of AGM which is being circulated for convening the AGM.

In view of the continuing COVID-19 pandemic, the Government of India, Ministry of Corporate Affairs vide its Circular No. 14/2020 dated April 08, 2020, Circular No. 17/2020 dated April 13, 2020 and Circular No. 20/20202 dated May 05, 2020 and also Securities Exchange Board of India vide its Circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated May 12, 2020, have permitted the holding of AGM through VC/OAVM, without the physical present of the members at

a common venue in compliance with these circulars and the relevant provision of the Companies Act, 2013 and the SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015, the AGM of the Company through VC/OAVM.

In accordance with the aforesaid circulars, Notice of the AGM along with Annual Report 2020-2021 is being sent only by electronic mode to those members whose Email addresses are registered with the Company/Depositories. Members may note that the Notice of AGM and Annual Report of 2020-2021 made available on Company's website: https://www.indoussagriseeds.com/, website of Stock Exchange i.e. BSE Limited at www.bseindia.com and AGM Notice will also be made available on website of NSDL (agency for providing remote e-voting facility) i.e. www.evoting.nsdl.com. Members can attend and Participate in the AGM through VC/OAVM facility only. The instructions for joining the AGM are provided in the Notice of the AGM. Members attending the meeting through VC/OAVM shall be counted for the purpose of reckoning the quorum as per Section 103 of the Company is providing remote e-voting facility (remote e-voting) to all its members to cast

The Company is providing remote e-voting facility (remote e-voting) to all its members to cast their votes on all resolutions as set out in the Notice of AGM. Additionally, the Company is

providing the facility voting through e-voting system during the AGM (e-voting) detailed procedure for remote e-voting is provided in the Notice of AGM.

In case members have not registered their email addresses with the Company/Depository,

ease follow the below instructions to register email address for obtaining Annual Report and

For members holding shares in physical mode – Please provide necessary details like Folio No., Name of Shareholder by email to indouscs@gmail.com

Members holding shares in demat mode can get their email ID registered by contacting

The 17th AGM Notice will be sent to the shareholders holding shares as on benpos date for the dispatch in accordance with the applicable laws on their registered email addresses in due

In case you have any queries or issues regarding e-voting, you may refer the Frequently Asked Questions ("FAQs") and e-voting manual available at www.evoting.nsdl.com.

For, Indo Us Bio Tech Limited

SD/- Jagdish Ajudia Chairman & Managing Director

their respective depository participant or by email to indouscs@gmail.com.

CHANGE OF NAME

I have changed my old name from **PATEL KHUSHALI** GORDHANBHAI to new nam THUMMAR KHUSHALI **GORDHANBHAI**

Add.: 39, Madavbaug Tenament, Nr. Jivanwadi Nikol Ahmedabad-50 1821

CHANGE OF NAME

I have changed my old name from **OMKARNATH** VALENATH JOGINATH to new name **OMKARNATH** VALENATH JOGI Add.: A-11, Zankar Flats, Paldi, Ahmedabad-380007 182

MAHASAGAR TRAVELS LTD.

CIN NO:L63040GJ1993PLC020289

Registered Office: MAHASAGAR HOUSE JAY SHREE TALKIES ROAD KALWA CHOWK, JUNAGADH-362001, INDIA, Tel: +0285 262 7611 Fax: +0285 262 7611 Email:mahasagartravels@gmail.com website: www.mahasagartravels.com

NOTICE

Notice is hereby given that 28th Annual General Meeting of MAHASAGAR TRAVELS LIMITED will be held on Thursday, the 30th September, 2021 at 10.00 AM at "Mahasagar House" Javshree Road, Kalwa Chowk, Junagadh - 362001 to transact the businesses as mentioned in the notice dated 14th August, 2021 The notice of the 28th AGM and Annual report for the period of 2020-21 have been sent to the shareholders at their Registered Address available with the company and are also available on the website of the company www.mahasagartravels.com

Notice is further given pursuant to section 91 of the Companies Act, 2013 and Regulation 42 of the LODR, 2015 that the Register of Members and Share transfer Books of the company will remain closed from Thursday, 23rd September, 2021 to Thursday, 30th September, 2021 (Both days inclusive) for the purpose of ensuing 28th Annual General Meeting of the Company.

As per Section 108 of the Companies Act, 2013 read with the Rule 20 of the Companies (Management and Administrative) Rules, 2014 the company has provided its shareholders the facility to cast their vote by electronic means (E -voting) on all the resolution set forth in the notice. The details are required pursuant to the provision of the Companies Act, 2013and rules are given under:

1	Date of completion of sending of Notices :	06 th September, 2021
2	Date & Time of commencement of voting through electronic means :	Monday, 27th September, 2021 at 10:00 AM IST
3	Date & Time of end of voting through electronic means :	Wednesday 29 th September, 2021 at 5:00 PM IST
4	Voting through Electronic means shall not be allowed beyond:	Wednesday 29th September, 2021 at 5:00 PM IST
5	The Notice of 28 th AGM is available on Company's website & on CDSL website:	www.mahasagartravels.com, www.evotingindia.com
6	Cut-off date for determining	Thursday, 23 rd September,

Mr. Nilesh Dalwadi Contact details of person responsible to address the Email:nilesh.dalwadi@ grievances connected with the electronic voting: 506-508, Amarnath Business

of E-voting:

linkintime co in Link Intime (India) Pvt. Ltd., Centre-1. Besides Gala Off. C. G. Road, Navrangpura

Business centre, Near St. Xavier's Collage Corner, Ahmedabad-380009 Contact: 079 26465179

Facility for voting through ballot paper shall be available at the AGM and members who have not cast their vote through note E-voting shall be able to vote at the AGM.

Members who have cast their vote through remote E-voting prior to the AGM may attend the AGM but shall not be entitled to cast their vote again.

Any person who becomes a member of the Company after

dispatch of the Notice of the meeting and holding shares as on the cut –off date i.e. Thursday 23rd September, 2021 may obtain user ID and password by sending a request at helpdesk.evoting@cdslindia.com
Any person whose name is recorded in the register of

members or in the register of beneficial owners maintained by the depositories as on cut off date i.e. Thursday, 23rd September, 2021 only shall be entitled to avail the facility of remote E-voting as well as voting in general meeting.

For, and On behalf of the Board Sd/- Bhagchand Sukhwani

Managing Director Place : Junagadh : 06-09-2021 (DIN:00579112)

AMRAPALI INDUSTRIES LTD

CIN: L17200GJ2014PLC078738 Unit No. PO5-02E, 5th Floor, Tower A WTC Gift City, Gandhinagar-382355

Contact No.+917926581329, E-mail ID: ail@amrapali.com, Website: www.amrapalispot.com.

NOTICE OF THE 33rd ANNUAL GENERAL MEETING OF THE COMPANY AND E-VOTING

NOTICE is hereby given that in accordance with the Circular No. 20 dated May 5, 2020 read with Circular No. 14 dated April 8, 2020 and Circular No. 17 dated April 13, 2020and Circular no. 02/202 dated January 13, 2021 in relation to "Clarification on holding of annual general meeting (AGM) through video conferencing (VC) or other audio visual means (OAVM)" (hereinafter collectively referred to as "MCA Circulars") issued by Ministry of Corporate Affairs ("MCA") for holding of Annual General of Amrapali Industries Limited be held on Tuesday, September 28, 2021 at 05:00P.M. at the registered of the Company situated at Unit No. PO5-02E, 5th Floor, Tower A WTC Gift City, Gandhinagar-382355 and through Video Conferencing ("VC") / Other Audio Visual Means ("OAVM") to transact the Ordinary Businesses and Special Businesses as set out in the notice of 33rd AGM.

In accordance with the General Circular No. 20/2020 dated May 5, 2020 read with General Circular No. 14/2020 dated April 8, 2020, General Circular No. 17/2020 dated April 13, 2020 and General Circular No. 02/2021 dated January 13,2021, issued by the Ministry of Corporate Affairs and Circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated May 12, 2020 and Circular No. SEBI/HO/CFD/CMD2/ CIR/ P/2021/11 dated January 15, 2021 issued by the Securities Exchange Board of India (SEBI) the Notice of AGM along with Annual Report 2020-21 have been sent through electronic mode only to those Members whose email addresses are registered with the Company/ Depositories. Member may note that Notice and Annual Report 2020-21 have been uploaded on the website of the Company at www.amrapalispot.com.website of BSE Limited at www.bseindia.com and website of Nationa Securities Depository Limited (NSDL)i.e. www.evoting.nsdl.com.

In light of the MCA Circulars, the shareholders whether holding equity shares in demat form or physical form and who have not submitted their email addresses and in consequence to whom the notice of 33rd AGM and Annual Report 2020-21 could not be serviced, may temporarily get their email addresses registered by following the procedure given below:

1. In case shares are held in physical mode, please provide Folio No., Name of shareholder, scanned copy of the share certificate (front and back), PAN (self-attested scanned copy of PAN card), AADHAR (self-attested scanned copy of Aadhar Card) by email to ail@amrapali.com

2 .In case shares are held in demat mode, please provide DPID-CLID (16 digit DPID + CLID or 16 digit beneficiary ID), Name, client master or copy of Consolidated Account statement, PAN (selfattested scanned copy of PAN card), AADHAR (self-attested scanned copy of Aadhar Card) to ail@amrapali.com.

3. Alternatively member may send an e-mail request to evoting@nsdl.co.in for obtaining User ID and Password by proving the details mentioned in Point (1) or (2) as the case may be. Post successful registration of the e-mail address, the shareholder would get soft copies of notice of 33rd and Annual Report 2020-21 and the procedure for e-voting along with the user-id and the password to enable e-voting for 33rd AGM. In case of any queries, shareholder may write to the Company at ail@amrapali.com. Shareholders are requested to register/ update their Email Ids with their Depository Participant(s) with whom they maintain their demat accounts if shares are held in dematerialized

mode by submitting the requisite documents There being physical shareholders in the Company, the Register of members and share transfer books of the Company will be closed from Wednesday, September 22, 2021 to Tuesday, September 28, 2021. Members whose names are recorded in the Register of Members or in the Register of Beneficial Owners maintained by the Depositories as on Tuesday, September 21, 2021 ("Cut-off date"), shall only be entitled to avail the facility of remote e-voting as well as e-voting on the Annua General Meeting

Pursuant to the provisions of Section 108 of the Companies Act, 2013 read with Rules made thereunder (as amended) and Regulation 44 of SEBI (LODR) Regulations, 2015 (as amended) and above mentioned MCA Circulars, the Company is providing facility of remote e-voting and e-voting on the date of the AGM to its Members in respect of the businesses to be transacted at the AGM. For this purpose, the Company has entered into an agreement with NSDL for facilitating voting through

The remote e-voting will commence on 9:00 A.M. on Saturday, September 25, 2021and will end on 5:00 P.M. on Monday, September 27, 2021. During this period, the members of the Company holding shares as on Cut-off date may cast their vote electronically (Remote E-Voting). Members may note that a) the remote e-voting module shall be disabled by NSDL after the aforesaid date and time for voting and once the vote on a resolution is cast by the member, the member shall not be allowed to change it subsequently; b) the facility of e-voting shall be made available at the 33rd AGM; and c) the members who have cast their vote by remote e-voting prior to the 33rd AGM may also attend the 33rd AGM but shall not be entitled to cast their vote again. Detailed procedure for remote e-voting/ e voting is provided in the Notice of the 33rdAnnual Ğeneral Meeting.

Any person, who acquires shares of the Company and become member of the Company after dispatch of the Notice of AGM and holding shares as on the cut-off date i.e. Tuesday, September 21, 2021, are requested to refer to the Notice of AGM for the process to be adopted for obtaining the USER ID and Password for casting the vote.

In case of any queries for e-voting, you may refer the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-voting user manual for Shareholders available at the download section of www.evoting.nsdl.com or call on toll free no.: 1800-222-990 or send a request at evoting@nsdl.co.in.Members may also contact Ms. Ekta Jain, Company Secretary of the Company at the registered office of the Company or may write an e-mail to ail@amrapali.com or may call or +91-0288-2730088 for any further clarification.

Members can attend and participate in the Annual General Meeting at the registered office of the Company or through VC/OAVM facility. The instructions for joining the Annual General Meeting through VC/OAVM are provided in the Notice of the Annual General Meeting. In case the shareholders/members have any queries or issues regarding participation in the AGM you can write an email to evoting@nsdl.co.in or Call us: - Tel: 1800-222-990. Members attending the meeting through VC/OAVM or physically attending at the Registered Office shall be counted for the purposes of reckoning the quorum under Section 103 of the Companies Act, 2013.

> For, AMRAPALI INDUSTRIES LTD YASHWANT AMRATLAL THAKKAR Chairman& Managing Director DIN: 00071126

SAWACA BUSINESS MACHINES LIMITED

(CIN: L65910GJ1994PLC023926) Regd, Office: 45, Chinubhai Tower, Opp. Handloom House, Ashram Road, Ahmedabad-380009, India Phone:079-26583309 Webiste:sawacabusiness.com e-mail:sawacabusiness@yahoo.com

NOTICE OF 27TH ANNUAL GENERAL MEETING AND E-VOTING INFORMATION

NOTICE is hereby given that the Twenty seventh Annual General Meeting(AGM) of the Compan will beheld on Wednesday, 29th September, 2021 at 12:00 Noon through video conferencing VC)/ other audio visualmeans ("OAVM") to transact the business, asset out in the Notice of the AGM. The Company has sent the Notice of AGM along with Annual Report for Financial Yea 2020-21 on6th September, 2021, only through electronic mode, to the Members whose e-mail ic were registered with the Company/Depositories, in accordance with the Circulars issued by Ministry of Corporate Affairs dated May 5, 2020 read with its circulars dated April 08, 2020, April

13, 2020 & January 13, 2021 and SEBI circular dated May 12, 2020 and January 15, 2021.
As per Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companie (Management and Administration) Rules, 2014 as amended and Regulation 44 of the SEBI (LODR) Regulations, 2015 and Secretarial Standards on General Meetings ("SS2") issued by Institute of Company Secretaries of India, members are provided with facility to cast their vote or all the resolutions set forth in the said Notice, using electronic voting system(e-voting) provided by Central Depository Services (India) Limited. The voting rights of the Members shall be in proportion to the equity shares held by them in the paid-up equity share capital of the Company as on Tuesday,14thSeptember, 2021("cut-off date"). The details as required pursuant to the provisions of the Companies Act, 2013 and Rules made thereunder are given below:

The Book Closure period shall commence on 14th September, 2021 and end on 29th September, 2021 (Both Days Inclusive);

The remote e-voting shall commence on Sunday, September 26, 2021 (09:00 AM) and end-on Tuesday, September 28, 2021 (5:00 PM).;

Cut-off date for determining rights of entitlement of e-voting is Tuesday, 14th September, 2021 The members will not be allowed to vote through remote e-voting beyond the period as specified above:

Shareholder acquiring the shares of the Company and becomes Members of the Company after sending of the Notice and holding Shares as of the Cut-off date may follow steps mention

in the Notice of AGM to exercise their voting rights;
E-voting facility will be available during the AGM. Members who have cast their votes by remote e-voting on resolutions before the AGM, may remain present at the AGM through

VC/OAVM but shall not be entitled to cast their vote on such resolutions again;

The Board has appointed M/s. Mukesh H. Shah & Co., Company Secretaries as Scrutinizer to

scrutinize the e-voting procedure, who shall submit the results of voting to the Chairman; In case shareholders have any queries regarding e-voting, they may refer the Frequently Asked Questions ('FAQs') and e-voting manual available at www.evotingindia.com, unde help section or send an e-mail at helpdesk@cdslindia.com or contact at 022-23058542/43.

By Order of the Board of Director

Place:-Ahmedabad Date: 07th September, 2021

company / depository.

For, SAWACA BUSINESS MACHINES LIMITED Sd/-SHETAL SHAH ManagingDirector DIN:02148909

AARNAV FASHIONS LIMITED

Regd. Office: 1, New Cloth Market, O/s, Raipur Gate, Raipur, Ahmedabad - 380 002. Phone: 079-29702983 Email: aarnavfashions@gmail.com Website: www.aarnavgroup.com CIN No.: L17100GJ1983PLC028990

NOTICE

Notice is hereby given that the 38th Annual General Meeting of the members of the Company will be held at 03:00 P.M.on Thursday, 30th September, 2021 a Survey No. 302, Isanpur, Gopi Compound, Narol - Vatva Road, Narol, Ahmedabad 382405. The notice setting out the business to be transacted in 38th AGM togethe with the 38th Annual Report of the Company for the Financial Year 2020-2021 has been dispatched to the members at their registered addresses and is available on the Company's website www.aarnavgroup.com. Further the copy of notice of the 38th AGM is also available on website of CDSL at www.evotingindia.com The notice of the 38th AGM and Annual Report has also been made available electronically to those members who have registered their email IDs with the

Pursuant to section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management & Administration) Amendment Rules, 2015 & regulatior 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Company shall provide Remote E-Voting facility to its members through the e-voting services provided by CDSL in respect of the businesses to be transacted as mentioned in the notice of 38th AGM of the Company.

Any person, who acquires shares of the Company and become a member of the Company after dispatch of the notice and holding shares as of the cut-off date i.e., Thursday, September 23, 2021 may obtain the login id and password by sending a request at helpdesk.evoting@cdslindia.com

The voting rights of members shall be in proportion to their shares of the paid p equity share capital of the Company as on the cut-off date i.e., September 23 2021. The e-voting period will commence on Monday, 27th September, 2021 9:00 A.M. and will end on Wednesday, 29th September, 2021, 5.00 PM.

Grievances, if any regarding e-voting procedure should be addressed to the MCS Share Transfer Agent Limited, 12/1/5, Manoharpukar Road, Ground Floor, Kolkata-700026 or at mcsahmd@gmail.com (033-40724051/52/53) or contact to Mr. Rakesh Dalvi, Sr. Manager, (CDSL) Central Depository Services (India) Limited, A Wing, 25th Floor, Marathon Futurex, Mafatlal Mill Compounds, N M Joshi Marg, Lower Parel (East), Mumbai - 400013 or send an email to helpdesk.evoting@cdslindia.com or call on 022-23058542/43. Once a vote on resolution is casted and submitted the members shall not be allowed to change it subsequently.

The facility for voting through poll paper shall be made available at the 38thAGM and the members attending the AGM, who have not cast their vote by remote e-voting, shall be eligible to exercise their voting rights at the AGM through Poll paper. A member may participate in the AGM even after exercising his right to vote through remote e-voting but shall not be allowed to vote again in the AGM Person whose name is recorded in the register of members maintained as or September 23, 2021 shall be entitled to vote.

BOOK CLOSURE

Pursuant to Section 91 of the Companies Act, 2013 including rules, and regulation 42 of SEBI (Listing Obligation and Disclosure Requirement) Regulations 2015, the Register of Members and Share Transfer Book of the Company will remain closed Friday, September 24, 2021 to Thursday September 30, 2021 (both days inclusive), for the purpose of the 38th AGM.

Date: 04/09/2021

For, Aarnav Fashions Limited sd/- Sumit Champalal Agarwal Managing Director, DIN: 00356863

YURANUS INFRASTRUCTURE LIMITED

CIN - L74110GJ1994PLC021352 Reg. Office: 201, Maulik Arcade, Above Karnavati Pagarkha Bazar, Mansi Cross Road, Vastrapur, Ahmedabad - 380 015 E-mail Id: info@yuranusinfra.com, Website: www.yuranusinfra.com NOTICE TO THE MEMBERS

Notice is hereby given that the 27th Annual General Meeting "AGM") of the Members of Yuranus Infrastructure Limited ("the company") is scheduled to be held on Tuesday, September 28, 2021 at 12.30 p.m. (IST) through Video Conferencing ("VC") Other Audio Visual Means ("OAVM") to transact the business as set out in the notice of the AGM. The AGM will be held only through VC/OAVM in compliance with

he provisions of the Companies Act, 2013 and general circulars dated May 5, 2020, April 8, 2020, April 13, 2020 and January 13, 2021 issued by the Ministry of Corporate Affairs (collectively referred to as "MCA Circulars"), read with SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015 ("SEBI Listing Regulations"). Facility for the appointment of proxy will not be available for the AGM. Notice of the AGM along with the annual report 2020-21 have sent

only through electronic mode to those members whose email addresses are registered with the company Or National Securities Depository Limited (NSDL) or Central Depository Services (India) Limited (CDSL). ("Depositories") and are also be available on the company's website www.yuranusinfra.com and on the website of BSE Limited www.bseindia.com and the website of National Securities Depository Limited (NSDL) https://www.evoting.nsdl.com The manner of voting remotely for members holding shares in dematerialized/ physical mode and members who have not registered their email addresses is provided in the Notice.

The company has engaged the services of NSDL as the authorized agency for conducting the e-AGM and for providing e-voting facility Members can cast their votes online from 9.00 a.m. (IST) on Saturday, September 25 2021 to Monday, September 27, 2021 till 5.00 p.m. (IST), at the end of remote e-voting period, the facility shall be disabled. Facility for e-voting shall also be made available during the AGM to those members who attend the AGM and who have not already cast their vote. The members who have cast their votes by remote e-voting prior to the AGM may also attend/ participate in the AGM through VC/OAVM but shall not be entitled to cast their vote again.

Only those members whose names are recorded in the register of members or in the register of beneficial owners (in case of electronic shareholding) maintained by the depositories as on the cutoff date i.e. September 20, 2021 shall be entitled to avail the facility of remote e-voting. Login credentials for casting votes through eoting are made available to members through email.

Any person who acquires shares of the company and becomes a member of the company after the Notice has been sent electronically by the company and holds shares as on the cut-of dated i.e. September 20, 2021 may generate login credentials by following the instructions provided in the Notice. However, if the person is already registered with NSDL for remote e-voting then the existing user id and password can be used for casting vote The same login credentials shall be used for attending the AGM. Mr. Amrish Gandhi, Practicing Company Secretary (FCS No. 8193, PCS No.5656) has been appointed as the scrutinizer to scrutinize e-voting process in a fair and transparent manner.

Register of members and share transfer books of the company shall remain closed from Tuesday, 21st September, 2021 to Tuesday, 28th September, 2021 (both days inclusive) for the purpose of determining entitlement of members for attending Annual General Meeting.

In case of any queries, you may refer the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-voting user manual for Shareholders available at the download section of www.evoting.nsdl.com or call on toll free no.: 1800-222-990 and 1800 22 44 30 or can contact NSDL on evoting@nsdl.co.in or contact Further, please find below details of NSDL officials for gueries By order of Board of Directors

Yuranus infrastructure Ltd. sd/- Mohit Dinesh, Desa Managing Director DIN: 03089420

Date: 06/09/2021 Place: Ahmedabad.

Date: 6th September, 2021 (DIN-01745951) Date: September 7, 2021

Place: Ahmedabad

Place: Ahmedabad

login details for e-voting.

Ahmedabad, Page 7

Western Times

AHMEDABAD TUESDAY 7/9/2021

प्रेस्टर्भ टाइक्स

વેસ્ટર્ન ટાઇમ્સમાં પ્રકાશિત જાહેરાતો અંગે વાંચકોએ પોતાની રીતે ચકાસણી કરી નિર્ણય લેવો.

-જાહેરખબર મેનેજર

નામ બદલેલ છે મે મારૂ જૂનુ નામ હિમાંશુ પ્રવિણભાઈ મણિયાર હતું જે બદલીને હિમાંશુ પ્રવિણચંદ્ર

મણિયાર કરેલ છે. સરનામું : એમ/૨/૭, પ્રગતિનગર ફલેટ, ટયુબવેલ સ્ટેશનની બાજુમાં, નારણપુરાં, અમદાવાદ-૩૮૦૦૧૩

પશ્ચિમ રેલ્વે–વડોદરા ડિવિઝન

સુધારો (કોરિજેન્ડમ) તારીખ 11.08.2021 ની ટેન્ડર નોટિસ નં. ડીઆરએ બીઆરસી 068 થી 069 વર્ષ 2021–22 ના ટેન્ડર નં ડીઆરએમ બીઆરસી 069 વર્ષ 2021–22 ના ટેન્ડર દસ્તાવેજમાં સુધારો. તારીખ 11.08.2021 ની ટેન્ડર નોટિસ નં. ડીઆરએમ બીઆરસી 068 થી 069 વર્ષ 2021–22 हेઠળ પ્રસિદ્ધ કરવામાં આવેલ ટેન્ડર નં ડીઆરએમ/બીઆરસી/069 વર્ષ 2021–22 **આથી** ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવે છે. ડબલ્યુ/

અમને કોલો કરોઃ 🛂 www.twitter.com/WesternRly પશ્ચિમ રેલ્વે-વડોદરા ડિવિઝન

623/એનઆઇટી વર્ષ 2021-22 તારીખ

BRC-118

એન્જાનિયરીંગ વિભાગ

ઇ-ટેન્ડર નોટિસ નં. ડીઆરએમ-બીઆરસી 079 વર્ષ 2021-2022 ડેવિઝનલ રેલ્વે મેનેજર (ડબલ્યુએ/સી), પશ્ચિમ રેલ્વે, પ્રતાપનગર, વડોદરા 390004 ભારતના રાષ્ટ્રપતિ માટે અને વતી નીચેના કામ માટે સીલબંધ ટેન્ડરો આમંત્રિત કરે છે:**– અનુ. નં 1. ટેન્ડર નં.** અને કામનું નામઃ <u>ડીઆરએમ બીઆરસી 079 વર્ષ</u> <u>2021–22.</u> વકોદરા કિવિઝનઃ– નબીપુર અને કનિજ સ્ટેશન ખાતે ઈન્કોર અને આઉટકોર સીગ્નલિંગ બદલવા બાબતમાં ઇલેક્ટ્રિકલ (પી) કામો भित भिवित केन्क्रानियरींग हामो कर्ने अन्य સંકળાયેલ કામો અને નડીઆદ સ્ટેશન ખાતે સીએસઆઈ સ્ટોર, આણંદ અને નડીઆદ સ્ટેશન ખાતે એસ એન્ડ ટી કેબલના સંગ્રહ માટે એમએસડીએસી હ્રારા એએફટીસી અને એસ એન્ડ ટી ઉપકરણ શિફ્ટ કરવા સાથે સંબંધિત એલસી નં 275 અને 295 ખાતે નવું ડ્યૂટી બંક. **કામની** અંદાજિત કિમતઃ (રૂપિયામાં)ઃ 6,49,76,606.07/-જમા કરવાના અર્નેસ્ટ મની (3પિયામાં): બીક સિક્યોરિટી ઘોષણા મુજબ. **ટેન્ડર રજૂ કરવાની અને** ટેન્ડર ખૂલવાની તારીખ અને સમયઃ ટેન્ડર **01.10.2021** ના રોજ 15.00 કલાક અથવા પહેલ રજૂ કરવાનું રહેશે અને તે જ તારીખે 15.30 કલાંકે ખોલવામાં આવશે. **વેબસાઇટની વિગતો અને** લોકેશન માટેની નોટિસ જ્યાં ટેન્ડરની સંપૂર્ણ વિગતો જોઈ શકાશે અને કચેરીનું સરનામું જ્યાંથી ટેન્ડર ફોર્મ ખરીદી શકાશેઃ વેબસાઇટ @www.ireps.gov.in ડેવિઝનલ રેલ્વે મેનેજર (ડબલ્યુએ/સી)

મને ફોલો કરોઃ 🛂 www.twitter.com/WesternRly

રેલ્વે, પ્રતાપનગર, વકોદરા—4. **5બલ્ય**/**623**/

એનઆઇટી 2021-22 તારીખ 03.09.2021.

પશ્ચિમ રેલ્વે - અમદાવાદ ટેન્ડર આમંત્રિત કરવાની સૂચના

(WR-ADIOCOMM (6GSK)/2/ 2021-0/o SR DCM/ADI/WR તારીખ ૦૩.૦૯.૨૦૨૧) oi: DRM/COMM/37/2021-22

સિનિયર ડિવ્ઝિનલ કોમર્શિયલ મેનેજર, અમદાવાદ-ડિવિઝન, પશ્ચિમ રેલવે, ભારતના રાષ્ટ્રપતિ વૃતી, રસ ધરાવતા પક્ષો પાસેથી ટેન્ડર આમંત્રિત કરે છે, ભીમાસર (BMSB)ના વિકાસ માટે એક PPP મોડેલ . પર સામાન્ય વપરાશકર્તા સુવિધા તરીકે શેડ ટેન્ડરની વિગતો આ પ્રમાણે છે ; **ટેન્ડરનો** પ્રકારઃ ઓપન ટેન્ડર (સિંગલ પેકેટ સિસ્ટમ) **કામનું નામઃ** ભીમાસરનો વિકાસ (BMSB) ૧૦ વર્ષ સુધી PPP મોડેલ પર વૃર્તમાન માળખાની જાળવણી અને નવા ઇન્ક્રાસ્ટક્ચરની જોગવાઈ સાથે સામાન્ય વપરાશેકર્તા સુવિધા તરીકે શેડનો શેડ. કરારનો સમયગાળોઃ ૧૦ વર્ષ. ટેન્ડર દસ્તાવેજની કિંમત બિન-પરતપાત્ર અને oilor ટ્રાન્સફરેબલ : રૂ.૧૦,૦૦૦/-ટ્રેન્ડરની કિંમત માત્ર ડિમાન્ડ ડ્રાફ્ટ/બેક્કર ચેકના ૩૫માં સ્વીકારવામાં આવશે. **અર્નેસ્ટ** મની ડિપોઝિટ/ગેરંટી રકમઃ રૂ. ૫,૪૨,૫૦૦ (રૂપિયા પાંચ લાખ બેતાલીસ માત્ર ડિમાન્ડ ડ્રાર્ફ્ટ/બેક્કર ચેકના રૂપમાં સ્વીકારવામાં આવશે. ટેન્ડર દસ્તાવેજ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છેઃ પશ્ચિમ રેલવેની વેબસાઇટ www.wr.indianrailways.gov.in પર ઉપલબ્ધ છે. ટેન્ડર દસ્તાવેજ જારી કરવા: તમામ કામકાજના દિવસોમાં (૧૦.૦૦ કલાક. ૧૭.૦૦ કલાક સુધી.) શુદ્ધિકરણ જો કોઇ હોય તો કરવાની છેલ્લી તારીખ ૧૩.૦૯,૨૦૨૧ સુધી ટેન્ડર દસ્તાવેજના વેચાણની તારીખ અને સમય: ૨૭.૦૯.૨૦૨૧ના રોજ ૧૭.૦૦ કલાકે. ટેન્ડર ડોક્યુમેન્ટ મેળવવાની અને ખોલવાની તારીખ અને સમયઃ ૧૫ઃ૦૦ કલાક સુધીની રસીદ અને ૨૮.૦૯.૨૦૨૧ ના રોજ ૧૫:૩૦ કલાકે ખુલશે ટેન્ડર ખોલવાની જગ્યાઃ સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર, અમદાવાદ- ડિવિઝન, પશ્ચિમ રેલવે, DRMની ઓફિસ બિલ્ડિંગ, ચામુંડા બ્રિજ પાસે, અમદુપુરા, અમદાવાદ-૩૮૨૩૪૫ નોંધઃ -ટેન્ડર દસ્તાવેજ અને NIT સંબંધિત અન્ય તમામ માહિતી

Like us: 🖪 www.facebook.co

login details for e-voting.

www.wr.indian railways.gov.in

પર ઉપલબ્ધ છે.

મહાસાગર ટ્રાવે<u>લ્સ લિમિટેડ</u>

CIN NO:L63040GJ1993PLC020289 રજી. ઓફિસ: મહાસાગર હાઉસ, જયશ્રી ટેલકીસ રોડ, કાલવા ચોક, જુનાગઢ-૩૬૨૦૦૧, ભારત, ફો.+0285 262 7611 ફેક્સ: +0285 262 7611, Email:mahasagartravels@gmail.com website: www.mahasagartravels.com

नोटिस

આથી નોટિસ આપવામાં આવે છે કે **મહાસાગર ટ્રાવેલ્સ લિમિટેડ્**ની ૨૮મી વાર્ષિક સામાન્ય સભા ૩૦મી સપ્ટેમ્બર, ૨૦૨૧ને ગુરુવારના રોજ સવારે ૧૦.૦૦ વાગે 'મહાસાગર હાઉસ' જયશ્રી ટોકિજ રોડ, કાલવા ચોક, જૂનાગઢ-૩૬૨૦૦૧ ખાતે ૧૪મી ઓગસ્ટ, ૨૦૨૧ની નોટિસમાં જણાવેલ કોંમકાજ માટે મળશે. ૨૮મી વાર્ષિક સામાન્ય સભાની નોટિસ અને નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ નો વાર્ષિક અહેવાલ સભાસદો કંપનીમાં નોંધાયેલા સરનામે મોકલવામાં આવેલ છે અને કંપનીની વેબસાઈટ www.mahasagartravels.com; પર પણ ઉપલબ્ધ છે.

આથી એવી પણ નોટિસ આપવામાં આવે છે કે કંપની ધારા, ૨૦૧૩ની કલમ-૯૧ તેમજ એલઓડીઆર, ૨૦૧૫ના નિયમ ૪૨ અન્વયે કંપનીના સભ્યોના રજિસ્ટર તથા શેર ટ્રાન્સફર બુકસ **ગુરુવાર, તા. ૨૩મી સપ્ટેમ્બર,** ૨૦૨૧ થી **ગુરુવાર, તા. ૩૦મી સપ્ટેમ્બર, ૨૦**૨૧ સુધી (બન્ને દિવસો સહિત) ૨૭મી વાર્ષિક સામાન્ય સભા ના કામકાજ માટે બંધ રહેશે.

કંપની ધારા, ૨૦૧૩ની કલમ ૧૦૮ તથા કંપની (મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશન) નિયમો ૨૦૧૪ના નિયમ ૨૦ અન્વયે કંપની તેના સભાસદોને નોર્ટિસમાં જણાવેલા ઠરાવો ઉપર ઈલેક્ટ્રોનિક માધ્યમ (ઈ-વોટિંગ)થી મત આપવાની સુવિધા આપે છે. કંપની ધારા, રે૦૧૩ ની જોગવાઈ અને તેના નિયમો અનુસાર વિગતો નીચે જણાવેલ છે :

۹.	AGM ની નોટિસ મોકલવાની કામગીરી પૂર્ણ કર્યાની તારીખ :	દ ક્રી સપ્ટેમ્બર, ૨૦૨૧
ર.	ઈલેક્ટ્રોનિક માધ્યમથી મતદાનના પ્રારંભની તારીખ અને સમય :	૨૭મી સપ્ટેમ્બર, ૨૦૨૧, સોમવાર, સવારે ૧૦.૦૦ વાગે
з.	ઈલેક્ટ્રોનિક માધ્યમથી મતદાનના સમાપનની તારીખ અને સમય :	૨૯મી સપ્ટેમ્બર, ૨૦૨૧, બુધવાર સાંજે ૫.૦૦ વાગે
٧.	ઈલેક્ટ્રોનિક માધ્યમથી મતદાન મંજૂર ગણાશે નહીં :	ર૯મી સપ્ટેમ્બર, ૨૦૨૧, બુધવાર, સાંજે ૫.૦૦ વાગ્યા પછી
પ.	૨૮મી AGM ની નોટીસ કંપનીની અને સીડીએસએલની વેબસાઈટ પર ઉપલબ્ધ છે :	www.mahasagartravels.com; www.evotingindia.com
ξ.	ઈ વોટીંગના હક્ક નકકી કરવા માટેની કટ ઓફ તારીખ :	૨૩મી સપ્ટેમ્બર, ૨૦૨૧ ગુરુવાર
9.	ઈલેક્ટ્રિક મતદાન અંગે ફરિયાદ નિવારવા જવાબદાર વ્યક્તિની સંપર્ક વિગતો :	શ્રી નિલેશ દલવાડી ઈ-મેલ : nilesh.dalwadi@ linkintime.co.in સરનામુ : લીક ઈનટાઈમ (ઈન્ડિયા) પ્રા. લી., પ૦૬-૫૦૮ અમરનાથ બીઝનેસ સેન્ટર-૧ ગાલા બિઝનેસ સેન્ટરની બાજુમાં, ઝેવિયર્સ કોલેજ કોર્નરની પાસે, સી.જી. રોડ, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૯ ફોન : ૦૭૯-૨૬૪૬૫૧૭૯

બેલેટ પેપર દ્વારા મતદાનની સુવિધા એજીએમ ખાતે ઉપલબ્ધ કરવામાં આવશે અને જે સભ્યોએ રિમોટ ઈ વોટીંગ દ્વારા મત આપ્યો નથી તે એજીએમ ખાતે મત આપી શકશે.

જે સભ્યોૂએ એજીએમ પહેલા રિમોટ ઈ વોટીંગથી મત આપ્યો હશે તે એજીએમ માં હાજર રહી શકશે પરંતુ ફરી મત આપવા માટે હક્કદાર રહેશે નહીં.

જો કોઈ વ્યક્તિ મિટીંગની નોટિસ અપાયા બાદ કંપનીનો સભ્ય બને અને કટ ઓફ તારીખ **૨૩મી સપ્ટેમ્બર, ૨૦૨૧** બાદમાં શેર ધરાવતો હોય તે helpdesk.evoting@cdslindia.com પર વિનંતી કરીને યુઝર આઈડી અને પાસવર્ડ મેંળવી શકે છે.

જે વ્યક્તિનું નામ કટ ઓફ તારીખ **ગુરુવાર ૨૩મી સપ્ટેમ્બર, ૨૦૨૧** સુધીના રોજ સભ્યોના રજીસ્ટરમાં અથવા ડીપોઝીટરીર્સ દ્વારા જાળવવામાં ઑવતા બેનીફિસિયલ ઓનર્સ ના રજીસ્ટરમાં હશે તે જ રિમોર્ટ ઈ વોટીંગ અને સામાન્ય સભામાં મતદાનની સુવિધા મેળવવાને હક્કદાર રહેશે.

બોર્ડ માટે અને વતી સ**હી/- ભાગ્ચંદ** સુખવાણી મેનેજીંગ ડાયરેકટર (DIN: 00579112)

સાવાકા બિઝનેસ મશીન્સ લિ.

(સીઆઇએન: L65910GJ1994PLC023926) **રજિસ્ટર્ડ ઓફિસઃ** ૪૫, ચિનુભાઈ ટાવર, હેન્ડલૂમ હાઉસની સામે, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૯, ઈન્ડિય ફોનઃ ૦૭૯-૨૬૫૮૩૩૦૯ વેબસાઇટ: sawacabusiness.com e-mail:sawacabusiness@yahoo.com

૨७ મી વાર્ષિક સામાન્ય સભા અને ઈ-વોટિંગ બાબતની માહિતી આથી નોટિસ આપવામાં આવે છે કે, કંપનીની ૨૭ મી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) તા.ઃ બુધવાર, ૨૯મી સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ બપોરે ૧૨.૦૦ કલાકે વિડિયો કોન્ફરસિંગ (વીસી/ અન્ય ઓડિઓ રહમાં સહસ્મેર, રહેરા ના રાજ ખપાર ૧૨.૦૦ કલાક ાવાડવા કાન્ફરાસને (વાંસા) એન્ય આદિબા વિઝયુલ સાધનો (ઓએવીએમ) મારફત એજીએમની નોટિસમાં જણાવેલ કામો માટે મળશે. કંપરાં એજીએમની નોટિસ, જે સભ્યોના ઈમેલ એડ્રેસ કંપની/ડિપોઝિટરી પાસે નોંધાયેલ હોય તેઓને ઈલેક્ટ્રોનિક મોડ મારફત તા. ૬, સપ્ટેમ્બરના રોજ, કોર્પોરેટ એફર્સ મંત્રાલયના તા. પ, મે, ૨૦૨૦ના પરિપત્ર અને તા. ૮, એપ્રિલ, ૨૦૨૦ના પરિપત્ર અને ૧૩, જાન્યુઆરી, ૨૦૨૧ના પરિપત્રને વંચાણે લઈ તેમજ સંબીના પરિપત્ર તા. ૧૨, મે, ૨૦૨૦ અને ૧૫, જાન્યુઆરી, ૨૦૨૧ મુજબ કંપનીના ૨૦૨૦-૨૧ ના વાર્ષિક નાણાકીયરિપોર્ટ સહિત મોકલી આપેલછે.

વાહાડાયારવાટ સાહત માકલા આવલ છે. કંપની અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૧૦૮ અને કંપની નિયમો (વ્યવસ્થાપન અને વહીવટ), ૨૦૧૪ ના સુધારેલ નિયમ ૨૦ અને સેબી (એલઓડીઆર) ના નિયમ, ૨૦૧૫ ના નિયમ ૪૪, અને ઈન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઈન્ડિયા મારફત જારી કરવામાં આવેલ સામાન્ય સભા બાબતના સેક્રેટરીયલ સ્ટાન્ડર્ડ સર્વિસિસ (ઈન્ડિયા) દ્વારા ઈલેક્ટ્રોનિક વોટિંગ સિસ્ટમ (ઈ-વોટિંગ) મારફત આપવા માટેની સુવિધા પૂરી પાડવામાં આવેલ છે. સભ્યોના વોટિંગ માટેના અધિકાર તેમના દ્વારા તા. ૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૧ (કટ-ઓફ તારીખ) ના રોજ કંપનીના પેઇડ-અપ ઇક્વિટિ શેર કૅપિટલમાં ધારણ કરવામાં આવેલ ઇક્વિટિ શેરની ખ્યાના પ્રમાણમાં રહેશે. કંપની અધિનિયમ, ૨૦૧૩ અને તે મુજબ બનાવવામાં આવેલ નિયમોનું વિગતો

બૂક ક્લોઝરનો સમય ૧૪, સપ્ટેમ્બર, ૨૦૨૧ થી શરૂ થશે અને ૨૯, સપ્ટેમ્બર, ૨૦૨૧ ના રોજ પૂર્ણ

થશે. (બંને દિવસોનો સમાવેશ કરવામાં આવેલ છે.); ઈ-વોટિંગ રવિવાર, ૨૬, સપ્ટેમ્બર, ૨૦૨૧ (સવારના ૯.૦૦ કલાકે શરૂ થશે અને મંગળવાર, ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૧ (સાંજના ૫.૦૦ કલાકે) ના રોજ પૂર્ણ થશે;

વોટિંગના અધિકાર નક્કી કરવા માટેની કટ ઓફ તારીખેં મંગળવાર. ૧૪. સપ્ટેમ્બર. ૨૦૨૧ રહેશે: સભ્યો ઉપરોક્ત નક્કી કરવામાં આવેલ સમય બાદ તેમના વોટિંગના અધિકારનો ઉપયોગ કરી શકશે

. જે શેર ધારકો નોટિસ મોકલ્યા બાદ અને કટ-ઓફ તારીખ પહેલા કંપનીના શેર ધારણ કરે અને કંપનીન સભ્ય બને તેઓ એજીએમ નોટિસમાં જણાવ્યા મુજબની કાર્યવાહી કરી પોતાના વોટિંગના અધિકારન

ઉપયાગ કરા શકશ.; ઈ-વોટિંગ માટેની સુવિધા એજીએમ દરમ્યાન જ ઉપલબ્ધ રહેશે. જે સભ્યોએ પોતાનો વોટ નોટિસમાં જણાવેલ કામોં માટે એજીએમ પહેલા ઈ-વોટિંગ મારફત આપ્યો હોય, તેઓ એજીએમમાં વીસી/ઓએવીએમ મારફત હાજર રહી શકશે પરંતુ ફરીથી વોટ આપી શકશે નહીં; બોર્ડ દ્વારા મે. મુકેશ. એચ. શાહ એન્ડ કંપની, કંપની સેક્રેટરીઝ, ની ઈ-વોટિંગ કાર્યવાહીની ચકાસણી માટે સ્કટીનાઈઝરની નિમણૂક કરવામાં આવેલ છે, જેઓ વોટિંગના પરિણામો ચેરમેન શ્રી સમક્ષ રજૂ

કોઈ શેર ધારકને ઈ-વોટિંગ બાબતે કોઈ જાણકારી મેળવવી હોય તો, તેઓ WWW.evotingindia. ગાં રાદ (લેલ્ય) વિભાગમાં ઉપલબ્ધ વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો (એફએક્યુ) અને ઈ-વોર્ટિંગ મેન્યૂઅલમાંથી મેળવી શકે છે, અથવા helpdesk@cdslindia.com ઉપર ઈ-મેઇલ કરીને અથવા ફોન નં.૦૨૨-૨૩૦૫૮૫૪૨/૪૩ઉપર સંપર્ક કરીને મેળવી શકે છે. બાર્ડ ઓફ કાયરેક્ટરના આદેશથી For, સાવાકા બ્રિઝનેસ મશીન્સ લિ. વતી જા: અમદાવાદ સહી અવાચ્ય /- શેતલ શાહ મેનેજિંગ કાયરેક્ટર દીખઃ બ, સેપ્ટેમ્બર, ૨૦૨૧. કીઆઇએનઃ૦૨૧૪૮૯૦૯

તારીખઃ ७, સેપ્ટેમ્બર, ૨૦૨૧.

Indo Us Bio-Tech Limited

(CIN: L01122GJ2004PLC043550)

Regd. Office: 309, Shanti Mall, Satadhar Char Rasta, Opp. Navrang Tower,

Šola Road, Ahmedabad – 380061, Gujarat Phone No.: 079 27491807

Email ID: indouscs@gmail.com Website: https://www.indousagriseeds.com

Notice to the Shareholders of 17th Annual General Meeting

NOTICE IS HEREBY GIVEN THAT THE 17th ANNUAL GENERAL MEETING (AGM) of the members of the Company will be held on Wednesday, 29th September, 2021 at 11:00 AM through Video Conferencing ("VC")/Other Audio-Visual Means ("OAVM") to transact the businesses as set out in the Notice of AGM which is being circulated for convening the AGM.

In view of the continuing COVID-19 pandemic, the Government of India, Ministry of Corporate Affairs vide its Circular No. 14/2020 dated April 08, 2020, Circular No. 17/2020 dated April 13, 2020 and Circular No. 20/20202 dated May 05, 2020 and also Securities Exchange Board of India vide its Circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated May 12, 2020, have permitted the holding of AGM through VC/OAVM, without the physical present of the members at

a common venue in compliance with these circulars and the relevant provision of the Companies Act, 2013 and the SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015, the AGM of the Company through VC/OAVM.

In accordance with the aforesaid circulars, Notice of the AGM along with Annual Report 2020-2021 is being sent only by electronic mode to those members whose Email addresses are registered with the Company/Depositories. Members may note that the Notice of AGM and Annual Report of 2020-2021 made available on Company's website: https://www.indousagriseeds.com/, website of Stock Exchange i.e. BSE Limited at www.bseindia.com and AGM Notice will also be made available on website of NSDL (agency for providing remote e-voting facility) i.e. www.evoting.nsdl.com. Members can attend and Participate in the AGM through VC/OAVM facility only. The instructions for joining the AGM are provided in the Notice of the AGM. Members attending the meeting through VC/OAVM shall be counted for the purpose of reckoning the quorum as per Section 103 of the Company is providing remote e-voting facility (remote e-voting) to all its members to cast

The Company is providing remote e-voting facility (remote e-voting) to all its members to cast their votes on all resolutions as set out in the Notice of AGM. Additionally, the Company is

providing the facility voting through e-voting system during the AGM (e-voting) detailed procedure for remote e-voting is provided in the Notice of AGM.

In case members have not registered their email addresses with the Company/Depository,

please follow the below instructions to register email address for obtaining Annuál Report and

For members holding shares in physical mode – Please provide necessary details like Folio No., Name of Shareholder by email to indouscs@gmail.com

Members holding shares in demat mode can get their email ID registered by contacting

The 17th AGM Notice will be sent to the shareholders holding shares as on benpos date for the dispatch in accordance with the applicable laws on their registered email addresses in due

In case you have any queries or issues regarding e-voting, you may refer the Frequently Asked Questions ("FAQs") and e-voting manual available at www.evoting.nsdl.com.

their respective depository participant or by email to indouscs@gmail.com.

તારીખ : ૦૬-૦૯-૨૦૨૧

સ્થળ : જુનાગઢ

૨૦૦ કરોડની ખંડણી કેસમાં લીના મારિયા પોલની ધરપકડ

ઈડી દ્વારા પૂછપરછ કરાયાનાં બે સપ્તાહ બાદ દિલ્હી પોલીસની ઈકોનોમિક ઓફેન્સિસ વિંગ દારા એક્ટ્રેસ લીના મારિયા પોલની ૨૦૦ કરોડની ખંડણી ઉઘરાવવાના કેસમાં ધરપકડ કરાઈ છે. લીના ૨૦૧૩માં આવેલી ફિલ્મ મદ્રાસ કાફેમાં કામ કરી ચૂકી છે. તેના બોયફ્રેન્ડ સુકેશ ચંદ્રશેખર દ્વારા થોડા સમય પહેલા એક પ્રતિષ્ઠિત વેપારીના પરિવાર પાસેથી ૨૦૦ કરોડ રુપિયા પડાવાયા હતા. ચોંકાવનારી વાત એ છે કે, આ સમગ્ર કાંડને તેણે દિલ્હીની તિહાર જેલમાં બેઠા-બેઠા જ અંજામ આપ્યો

થોડા સમય પહેલા જ આ મામલે સુકેશ અને સાત અન્ય લોકોની ધરપકડ કરાઈ હતી, જેમાં એક બેંક મેનેજરનો પણ સમાવેશ કરવામાં આવ્યું હતું.

નવી દિલ્હી, થાય છે. સુરેશ વિરુદ્ધ પોલીસે મકોકા લગાવ્યો છે, જ્યારે લીના સહિતના લોકોને સહઆરોપી બનાવવામાં આવ્યાં છે. ૧૦ ઓગસ્ટના રોજ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા દ્વારા આ સનસનીખેજ કાંડનો અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં આજ સધી ૨૦૦ કરોડ રુપિયાની ખંડણી વસૂલાઈ હોય તેવો કોઈ કેસ નથી બન્યો. તેમાંય આ કેસમાં તો આરોપીએ જેલમાં બેઠા-બેઠા જ આખાય કાંડને અંજામ આપ્યો હતો. પોલીસ ઉપરાંત ઈડીએ પણ આ કેસમાં તપાસ શરુ કરી હતી. ૨૩ ઓગસ્ટના રોજ ઈડીએ આ કેસમાં ૧૬ લક્ઝુરિયસ ગાડીઓ જપ્ત કરી હતી. આ સિવાય ચેજ્ઞેમાં બીચ પર આવેલો એક બંગલો, ૮૨.૫ લાખ કેશ તેમજ ૨ કિલો સોનુ પણ જપ્ત

આર્નવ ફેશન્સ લિમિટેડ

રજીસ્ટર્ડ ઓફિસ : 1, ન્યુ કેલોથ માર્કેટ, રાયપુર દરવાજાની બહાર, રાયપુર, અમદાવાદ - 380002 Phone : 079-29702983 Email:aarnavfashions@gmail.com Website:www.aarnavgroup.com CIN No: L17100GJ1983PLC028990

नोटिस

નોટિસ આપવામાં આવે છે કે કંપનીના સભ્યોની **૩૮મી વાર્ષિક સાધારણ સભા** ગુરૂવાર, ૩૦મી સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ બપોરે ૩.૦૦ વાગે સર્વે નં. ૩૦૨ ઈસનપુર, ગોપી કમ્પાઉન્ડ, નારોલ - વટવા રોડ, નારોલ, અમદાવાદ- ૩૮૨૪૦૫ ખાતે યોજાશે. નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૦૨૧ માટે ના કંપનીના ૩૮માં વાર્ષિક રિપોર્ટ સાથે ૩૮મી AGM માં રજૂ થનારા બિઝનેસીસ સાથેની નોટિસ સભ્યોના રજિસ્ટર્ડ સરનામા પર મોકલવામાં આવી છે અને આ જ નોટિસ કંપનીની વેબસાઈટ www.aarnavgroup.com પર ઉપલબ્ધ છે. આ ઉપરાંત ૩૮મી AGM ની નોટિસની નકલ CDSLની વેબસાઈટ www.evotingindia.com પર પણ ઉપલબ્ધ છે.

૩૮મી AGM અને વાર્ષિક અહેવાલ ની નોટિસ તે સભ્યોને ઈલેકટ્રોનિક રીતે ઉપલબ્ધ કરાવવામાં આવી છે જેમણે કંપની / ડિપોઝટરીમાં તેમના ઈમેઈલ્ આઈડી રજીસ્ટર કરાવ્યા છે. કંપનીઝ એકટ, ૨૦૧ ૩ની કલમ ૧૦૮ કંપનીઝ (મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન)

સુધારા નિયમો, ૨૦૧૫ના નિયમ ૨૦ અને કંપનીના સ્ટોક એક્ષચેન્જ સાથેના (લિસ્ટીંગ ઓબ્લીગેશન અને ડિસ્કલોઝર રિક્વાયરમેન્ટસ) એગ્રીમેન્ટની કલમ ૪૪ સાથે વાંચતા ૩૮મી AGM માં બિઝનેસ ટ્રાન્ઝેકટ કરવાના સંદર્ભમાં સીડીએસએલ દ્વારા તેના સભ્યોને ઈ-વોટિંગની સુર્વિધા આપવામાં આવશે. કોઈ પણ વ્યક્તિ કે જે કટ ઓંફ તારીખ એટલે કે ગુરૂવાર, ૨૩મી સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ કંપનીના શેર ધરાવે છે અને આ નોટિસ ડીસ્પેચ થયા પછી તેઓ

કંપનીના સભ્ય બન્યા હોય તેઓ helpdesk.evoting@cdslindia.com પર

વિનંતી કરીને Login ld અને પાસવર્ડ મેળવી શકે છે. કટ ઓંફ તારીખ એટલે કે ૨૩મી સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ કંપનીના પેઈડ અપ શેર કેપિટલમાં તેમના શેરના પ્રમાણમાં સભ્યોને મતદાનનો અધિકાર મળશે. ઈ વોટિંગનો સમય સોમવાર, ૨૭મી સપ્ટેમ્બર, ૨૦૨૧, સવારે ૯.૦૦ થી શરૂ થશે

અને બુધવાર, ૨૯મી સપ્ટેમ્બર, ૨૦૨૧ સાંજે ૫.૦૦ વાગે સમાપ્ત થશે. ફરિયાદો, ઈ-વોટિંગ પ્રક્રિયા સંબંધિત હોય તો તે MCS શેર ટ્રાન્સફર એજન્ટ લિમિટેડ, 12/1/5, મનોહરપુકાર રોડ, ગ્રાઉન્ડ ફલોર, કોલકતા – 700026 ખાતે અથવા mcsahmd@gmail.com (033-40724051/52/53) પર જાણ કરવી અથવા શ્રી રાકેશ દલવી, સીનીયર મેનેજર (CDSL), સેન્ટ્રલ ડિપોઝટરી સર્વિસીસ (ઈન્ડિયા) લિમિટેડ, એ વીંગ, ૨૫મો માળ, મેરેથોન ફયુચરક્ષ, મફતલાલ મિલ કમ્પાઉન્ડસ એન એમ જાપી માર્ગ, લોઅર પરેલ (પૂર્વ), મુંબઈ- 400013 અથવા helpdesk.evoting@cdslindia.com પર ઈમેઈલ મોકલો અથવા 022 23058542 / 43 પર કોલ કરો. એક વાર ઠરાવ પર વોટ પોસ્ટ અને સબમીટ કર્યા પછી સભ્યોને તેને પછી થી બદલવાની મંજૂરી આપવામાં આવશે નહી.

૩૮મી AGM ખાતે મતદાન પેપર દ્વારા મત આપવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે અને AGM માં ભાગ લેનારા સભ્યો કે જેમણે રિમોર્ટ ઈ-વોટિંગ દ્વારા પોતાનો મત આપ્યો નથી તેઓ AGM માં મતદાન પેપર દ્વારા પોતાનો મત આપવાના અધિકારોના ઉપયોગ કરવાના પાત્ર રહેશે. એવા સભ્ય કે જેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ રિમોર્ટ ઈ-વોટિંગ દ્વારા કર્યો છે અને તેઓને AGM માં હાજર રહીને ફરીથી મતદાન કરવા માટેની મંજૂરી આપવામાં આવશે નહિ.

૨૩મી સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ જે વ્યક્તિનું નામ સભ્યોના રજિસ્ટરમાં નોંધાયેલું છે તે મત આપવા હકદાર રહેશે.

બરુ કલોઝર

સેબી (લિસ્ટિંગ ઓબ્લીગેશન અને ડિસ્કલોઝર રિકવાયરમેન્ટસ) રેગ્યુલેશન્સ ૨૦૧૫ના નિયમો અને નિયમન ૪૨ સહિત કંપનીઝ એકટ, ૨૦૧૩ની કલમ ૯૧ મુજબ સભ્યોનું રજિસ્ટર અને કંપનીનું શેર ટ્રાન્સફર બુક શુક્રવાર રજમી સપ્ટેમ્બર ૨૦૨૧ થી ગુરુવાર ૩૦મી સપ્ટેમ્બર ૨૦૨૧ (બંને દિવસ સહિત) સુધી ૩૮મી AGM ના હેતુથી બંધ રહેશે.

તારીખ : ૦૪-૦૯-૨૦૨૧ સ્થળ : અમદાવાદ

આર્નવ ફેશન્સ લિમિટેડ વતી સહી/- સુમીત ચંપાલાલ અગ્રવાલ મેનેજિંગ ડિરેક્ટર - DIN : 00356863

યુરેનસ ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડ

CIN - L74110GJ1994PLC021352 **રજિ. ઓફિસ** : ૨૦૧, મૌલિક આર્કેડ, કર્ણાવતી પગરાખા બજારની ઉપર, માનસી ક્રોસ રોડ, વસ્ત્રાપુર, અમદાવાદ-૩૮૦૦૧૫ ઇ-મેઇલ આઇ.ડી. : Info@yuranusinfra.com વેબસાઇટ : www.yuranusinfra.com

નોટિસ

આથી નોટિસ આપવામાં આવે છે કે, યુરેનસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (કંપની)ના સભ્યોની ૨૭મી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૧ ને મંગળવારે બપોરે ૧૨.૩૦ (IST) કલાકે યોજાવાની છે. વિડીયો કોન્ફરન્સિંગ ("VC") દ્વારા અન્ય ઓડિયો વિઝ્યુઅલ મીન્સ ("OAVM") દ્વારા એજીએમની નોટિસમાં જણાવ્યા મુજબ વેપારનો વ્યવહાર કરવા.

કંપની અધિનિયમ, ૨૦૧૩ ની જોગવાઈઓ અને કોર્પોરેટ મંત્રાલય દ્વારા જારી કરાયેલા પ મે, ૨૦૨૦, ૮ એપ્રિલ, ૨૦૨૦, ૧૩ એપ્રિલ, ૨૦૨૦ અને ૧૩ જાન્યુઆરી, ૨૦૨૧ ના સામાન્ય પરિપત્રોને અનુરૂપ વીસી/ઓએવીએમ દ્વારા જ એજીએમ યોજાશે. સેબી (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ્સ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ (સેબી લિસ્ટિંગ રેગ્યુલેશન્સ) સાથે વાંચેલ બાબતો (સામૂહિક રીતે એમસીએ પરિપત્રો તરીકે ઓળખાય છે). એજીએમ માટે પ્રોક્સીની નિમણૂકની સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં.

વાર્ષિક અહેવાલ ૨૦૨૦-૨૧ સાથે એજીએમની સૂચના માત્ર તે સભ્યોને ઇલેક્ટ્રોનિક મોડ દ્વારા મોકલવામાં આવી છે જેમના ઇમેઇલ સરનામાં કંપની અથવા નેશનલ સિક્ચોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (એનએસડીએલ) અથવા સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (ઇન્ડિયા) લિમિટેડ (સીડીએસએલ) સાથે નોંધાયેલા છે. (ડિપોઝિટરીઝ) અને કંપનીની વેબસાઇટ www.yuranusinfra.com અને BSE લિમિટેડની વેબસાઇટ www.bseindia.com અને નેશનલ સિક્ચોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL)ની વેબસાઇટ https: // www.evoting.nsdl.com પર પણ ઉપલબ્ધ છે.

ડિમટીરિયલાઇઝ્ડ/ ફિઝિકલ મોડમાં શેર ધરાવતા સભ્યો અને તેમના ઇમેઇલ સરનામાં નોંધાયેલા ન હોય તેવા સભ્યો માટે દૂરથી મત આપવાની રીત નોટિસમાં આપવામાં આવી

કંપનીએ ઈ-એજીએમ હાથ ધરવા અને ઈ-વોટિંગ સુવિધા પૂરી પાડવા માટે અધિકૃત એજન્સી તરીકે એનએસડીએલની સેવાઓ સામેલ કરી છે, સંબ્યો ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૧ થી શનિવાર, સોમવાર, ૨૭ સપ્ટેમ્બર, સવારે ૯.૦૦ (આઈએસટી) વાગ્યાથી ઓનલાઈન મત આપી શકે છે. ૨૦૨૧ સાંજે ૫.૦૦ (આઈએસટી) વાગ્યા સુધી , દૂરસ્થ ઇ-મતદાન અવધિના અંતે, સુવિધા અક્ષમ કરવામાં આવશે. જે સભ્યો એજીએમમાં હોજરી આપે છે અને જેમણે પહેલેથી જ પોતાનો મત આપ્યો નથી તેમને ઇજી-વોટિંગ માટેની સુવિધા પણ એજીએમ દરમિયાન ઉપલબ્ધ કરાવવામાં આવશે. જે સભ્યોએ AGM પહેલા રિમોટ ઈ-વોટિંગ દ્વારા પોતાનો મત આપ્યો છે તેઓ VC/ OAVM મારફતે AGM માં હાજરી આપી શકે છે/ ભાગ લઈ શકે છે પરંતુ ફરીથી મત આપવા માટે હકદાર રહેશે નહીં.

માત્ર તે જ સભ્યો કે જેમના નામ સભ્યોના રજિસ્ટરમાં અથવા લાભદાયી માલિકોના રજિસ્ટરમાં નોંધાયેલા છે (ઇલેક્ટ્રોનિક શેરહોલ્ડિંગના કિસ્સામાં) ડિપોઝિટરીઓ દ્વારા કટઓફ તારીખ એટલે કે ૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ જાળવવામાં આવે છે તે દૂરસ્થ ઇ ની સુવિધા મેળવવા માટે હકદાર રહેશે. મતદાન. ઇ-વોટિંગ દ્વારા મત આપવા માટે ઓળખપત્ર સભ્યોને ઇમેઇલ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

કોઈપણ વ્યક્તિ જે કંપનીના શેર હસ્તગત કરે છે અને કંપની દ્વારા ઇલેક્ટ્રોનિક રીતે નોટિસ મોકલવામાં આવ્યા બાદ કંપનીના સભ્ય બને છે અને કટ ઓફ તારીખ એટલે કે ૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૧ ના રોજ શેર ધરાવે છે તે આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરીને લોગિન ઓળખપત્ર પેદા કરી શકે છે. સૂચના. જો કે, જો વ્યક્તિ પહેલેથી જ રિમોટ ઇ-વોટિંગ માટે એનએસડીએલમાં નોંધાયેલ હોય તો હાલના યુઝર આઈડી અને પાસવર્ડનો ઉપયોગ મતદાન માટે કરી શકાય છે. એજીએમમાં હાજરી આપવા માટે સમાન લોગિન ઓળખપત્રોનો ઉપયોગ કરવામાં આવશે.

શ્રી અમરીશ ગાંધી, પ્રેક્ટિસિંગ કંપની સેક્રેટરી (FCS No. 8193, PCS No.5656) ને નિષ્પક્ષ અને પારદર્શક રીતે ઈ-વોટિંગ પ્રક્રિયાની ચકાસણી કરવા માટે સ્ક્રૂટિનાઈઝર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

સભ્યોની નોંધણી અને કંપનીના શેર ટ્રાન્સફર બુક મંગળવાર, ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૧ થી મંગળવાર, ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૧ (બંને દિવસો સહિત) વાર્ષિક સામાન્ય સભામાં ભાગ લેવા માટે સભ્યોની હકદારતા નક્કી કરવાના હેતુથી બંધ રહેશે.

કોઈપણ પ્રશ્નોના કિસ્સામાં, તમે શેરધારકો માટે વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs) અને www.evoting.nsdl.com ના ડાઉનલોડ વિભાગ પર ઉપલબ્ધ શેરધારકો માટે ઈ-વોટિંગ વપરાશકર્તા માર્ગદર્શિકાનો સંદર્ભ લઈ શકો છો અથવા ટોલ ફ્રી નંબરઃ ૧૮૦૦-૨૨૨-૯૯૦ પર ફોન કરી શકો છો. અને ૧૮૦૦ ૨૨ ૪૪ ૩૦ અથવા NSDL નો evoting@nsdl.co.in પર સંપર્ક કરી શકે છે અથવા આગળ સંપર્ક કરી શકે છે, કૃપા કરીને પ્રશ્નો માટે NSDL ના અધિકારીઓનો સંપર્ક સાધો.

युरेनस छन्झास्ट्रडयर सि.

વટવાની લેજેન્ડ ઇન્ડસ્ટ્રીઝે મંજૂરી વિના દવા બનાવતા, પ્રદૂષણ ફેલાવતાં રપે લાખનો દંડ

વટવામાં આવેલી લેજેન્ડ ઈન્ડસ્ટ્રીઝ કોઈ પ્રકારની મંજૂરી વગર લોહતત્વની દવા બનાવતી ઝડપાઈ હતી. આ ઉપરાંત એસીડ વાળું પાણી ખારીકટ કેનાલમાં છોડતી ઝડપાઈ ગઈ હતી. આ સિવાયના અનેક ગુનાઓ હોવા છતાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તેની સામે આંખ આડા કાન કરીને માત્ર ૨૫ લાખનો દંડ વસુલી અને કલોઝર નોટીસ આપી સંતોષ માની લેતા જીપીસીબીના બેવડા ધોરણ ખુલ્લા પડી ગયા છે.

થોડા દિવસ પહેલાં ખારીકટ કેનાલમાં એસીડવાળું પાણી છોડવામાં આવ્યું હતું. જેની તપાસનું પગેરૂ વટવામાં આવેલી લેંજેન્ડ ઈન્ડસ્ટ્રીઝ સુધી નીકળ્યું હતું. પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારી અનેક ચોકાવનારા કૌભાંડ ખુલ્લા પડયાં હતાં. મુકેશ પટેલની માલીકોની લેજેન્ડ ઈન્ડ.માં જીપીસીબીને મંજૂરી વગર ફેરસ એસ્કોબિક એસીડ એટલે કે લોહતત્વની દવાનું ઉત્પાદક કરાતું હતું. એટલું જ નહીં આ ફેકટરી પાસે ચામડીના રોગમાં કામ આવતી એન્ટીબાયોટીક દવા પ્રતી માસ બે ટન અને વિટામીન-બીની પ્રતી માસ દોઢ ટન અને વિટામીન-બીની પ્રતીમા માસ દોઢ બનાવવાની મંજૂરી હતી. આમ છતાં લેજેન્ડ ઈન્ડના માલીકે તેના કરતાં અનેકગણું ઉત્પાદન કરતાં હોવાનું ખુલ્યું હતું. આમ અનેક ગેરરીતિઓ ઝડપાઈ હોવા છતાં જીપીસીબીએ તેમના પ્રત્યે અગમ્ય કારણોસર કુણી લાગણી દર્શાવી

સી. એ,શાહે ત્યાં જઈને તપાસ કરતાં માત્ર ૨૫ લાખની ઈડીસી એન્વાયરમેન્ટલ ડેમેજ કોમ્પોન્સેન ફટકારાઈ છે. તેમજ ફેકટરીને કલોઝર નોટીસ આપવામાં આવી છે. સમગ્ર કારખાનેદાર આલમમાં ચર્ચા છે. કે આ લેજેન્ડ ઈન્ડસ્ટ્રીઝ એસીડવાળું પાણી ખારીકટ કેનાલમાં છોડવું, મંજુરી વગર દવાનો બનાવવી, જીએસટીના બીલો ન રાખવા, એસીડ, વાળા પાણીનો મટા જથ્થાનો સંગ્રહ કરવો મંજુરી છે. તેવી દવાઓનું નિયત જથ્થા કરતાં અનેકગર્ણું ઉત્પાદન કરવી સહિતની અનેક ગેરરીતિઓ આચરી છે. છતાં માત્ર રપ લાખનો દંડ ફટકારીને જીપીસીબીએ સંતોષ માની લેતાં જીપીસીબીના અધિકારીઓની નીતિ-રીતિ સામે શંકાની સોય તણાઈ છે.

\$GIજા નો ટીસ (સ્થાવર મિલ્કતા) માટેની નિચમ-૮ (૧) આઇઆઇએકએલ હોમ કાઇનાન્સ લિમીટેડ) (IIFL HFL)ના નીચે સહી કરનાર અધિકૃત અધિકારી સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ ૧૦૦૧ અંતર્ગત અને મિક્યોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ ૧૦૦૧ અંતર્ગત અને મીચે મુજની સદર નોટિસ માંગપીએ મને નીચે મુજની લીટ કેમ ચૂકવવા ડિમાન્ટ નોટિસ પાડલી હતી. દેવાદાર રકમ ચૂકવવામાં નિષ્કળ મીવડતા, દેવાદાર જામીનાદર અને જાહેર જનતાને નોટિસ આપવામાં આવે છે કે નીચે સહી કરનાર અધિકારી એ ક્યદાની કલમ ૧૩(૪) અને ઉપરોક્ત નિયમના નિયમ ૮ અન્વયે મળેલી સત્તાની રૂએ નીચે દર્શાવેલી નિયકતા કાળ એ લીધો છે. આથી દેવાદાર અને જાહેર જતાનો નોટિસ આપવામાં આવે છે કે નીચે સહી કરનાર અધિકારીએ ક્યદાની કલમ ૧૩(૪) અને ઉપરોક્ત નિયમના નિયમ ૮ અન્વયે મળેલી સત્તાની રૂએ નીચે દર્શાવેલી નિયકતા કાળ એ લીધો છે. આથી દેવાદાર અને જાહેર જતાનો ચેતલાશી આપવામાં આવે છે કે કોઈએ સદર મિલકત સંદર્ભ કોઈ પણ લેવા-દેવડ કરવી નહીં જો કોઈ વ્યક્તિ સદર મિલકત સંદર્ભ કોઈ પણ લેવા-દેવડ કરવી નહીં જો કોઈ વ્યક્તિ સદર વિલક્ત અંગે લેવાદી અ અલ ગામ પાટે કાલ (√)ની જોગવાઈઓ માટે અનુરોચન જો ઉધાર લેવાટા એલ અને અને અને અન્ય ખર્ચ સાથે, કોઈ પણ સમયે નિયત તારીખ પહેલાં વેચાણ અથવા દ્વાન્સક રાવામાં આવશે માં કીએ ને સુરક્ષિત અલ્લાવો સાથે માટે, સુરક્ષિત અલ્લાવો ચાણ માટે આઇએ અને એચએકએલ સાર વેચવામાં આવશા દ્વાન્સક રવામાં આવશે મહી. કે હોયકિત મિલ્કતનનું વર્શન કેવારો સાથે અને સુરક્ષિત અલ્લાનો માટે પચલે લામાં આવશે મહી. કેવાદારી/ સુરક્ષિત મિલ્કતનું વર્શન કેવાલ ક્લાક લેવાદા અલાકો અને કીડા અના સાથે મહિતા માટે. કેવાદારી/

عادهم الأحجمة معراب

જામીનદારોના નામો	(સ્થાવર મિલકત)	લેણાની રકમ રૂા.	વારીખ	વારીખ
മിചചി പ്രചരിച ദ്രമാവാർ	પ્લોટ નાં ૧૮ આશરે. ૭૭૨કે.મી. મહેશ્વરી નગર, બાંધકામ સર્વે નં. ૧૮ અને ૧૯ માંજે ચીત્રા, ક્ષિદક્સ રોડ, ભાવનગર, ગુજરાત ખાતે આવેલી મિલકત અને તેના બધા જ ભાગો સહિત	(Stustiere insule)	૧૨-માર્ચ-૨૦૨૧	૦૩-સપ્ટે-૨૦૨૧
पर माहिनी माउँ अ हि दन अ	الإدري والمراجع والمر	வர் உவர் கொ	ചിമാറിട്ട് പി	படி வலவரி

પસુ નાહાલા માટ બાયુક્ત ભાવકારાત્રામાં **હાય આફ્રિક**ા ગ્રાઇગ ફર્લાર, તહાર માનક, ાવકાર માટર પરંગ્યા પાર, સહકાર હાર્ટની સામે, વાધવાડી રોડ, ભાવનગર-૩૬ ૪૦૦૨ અને /અથવા **કોર્પોરેટ ઓફિસ**ાઓઇઓફએલ ટાવર પ્લોટ નં.૯૮ ફેસ-૪, ઉદ્યોગ વિહાર, ગુરગાંવ, હરીયાણા સંપર્ક કરવો. સહી/- અધિકૃત અધિકારી, IIFL હોમ ફાઇનાન્સ લીમીટેડ

ડીમાન્ડ નોટીસ

ાંગાનિક ભાગમાં તે કેલ્સ્ટ્રક્શન ઓફ ફાઇનાસ્સિયલ એસેટ્સ એલ એસિંગ્સ કેલ્સ્ટ્રિટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ ની કલમ ૧૩ (૨) હેઠળ (આ કાયદો) સિક્યુરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) ટ્રલ્સ, ૨૦૦૨ ના નિયમ (આ નિયમો) ૩(૧) સાથે વાંચવામાં આવ્યો છે. ઉપરોક્ત અધિનિયમની કલમ ૧૩(૧૨) હેઠળ આપવામાં આવેલ સત્તાઓના ઉપયોગમાં આ નિયમોના નિયમ ૩ ની સાથે વાંચતા, આઈઆઈએક્સે એલ કાંઇનાન્સ લિયિટેડ (IFL IFL) (અગાઇ ઇન્ડિયા ઇન્હોલઈન હાઇલેસ કાંઇનાન્સ લિયિટેડ)ના અધિકૃત અધિકારીએ જારે કર્યા છે. ઉપરોક્ત અધિનિયમની કલમ ૧૩ (૨) હેઠળ માંગુણી નોટિસ, ઉધાર લેનારા (ઓ) ને, તેઓને સંબંધિત ડિમાન્ડ નોટિસ (ઓ)માં જણાવેલ રકમ પરત કરવા માટે હાકલ કરે છે. ઉપરના સંબંધમાં, કરીથી આ સુચના પ્રકાશિત થયાની તારીખથી ૮૦ દિવસની અંદર લેલદાર (ઓ)ને યુકલણી કરવા માટે સૂચના આપવામાં આવે છે, ના વધુ વ્યાજ સાથે, નીચે જજ્ઞાવેલ રકમ, ઓ માંગણી સૂચના યુકલણીની તારીખ સુધી લેજ્ઞદાર (ઓ) ની વિગત, તારીખ મુજબની રકમ માંગની સૂચના અને લોનની રકમની યુકવણી માટે આપવામાં આવતી સુરક્ષા નીચે મુજબ છેઃ -

02-Sep-2021 Prospect No.757835	કલેટ નં.એ-૨૦૬ એરીયાનું માપ ૧૧૫૦ સ્કે.કીટ. બિલ્ડિંગ
Rs.1,08,881/- (રૂપિયા એક લાખ આઠ હજાર	નં.એ સાંઈ વાટીકા જમીન બીયરીંગ સબ ડિવીઝનલ પ્લોટ નં.૪,
આઠસો એકયાસી ફક્ત) Prospect No.	સિલીકોન ટાઉન બ્લોક નં.૧૪૫-ડી અને ૧૪૬ પૈકી (ન્યુ બ્લોક
757003 Rs.6,60,743/- (રૂપિયા છ લાખ	નં.૧૪૬/બી ગામ ચલથાણ તાલુકા પલસાણા સુરત, ગુજરાત,
સાંઇઠ હજાર સાતસો તેતાલીસ કક્ત)	ભારત ખાતે આવેલી મિલકતના બધા જ ભાગો સહિત
02-Sep-2021 Prospect No.770494	ફ્લેટ નં.એચ-૧૧૫ પહેલો માળ આશરે કાર્પેટ એરીયા ૪૩૩
Rs.11,19,322/- (રૂપિયા અગીયાર લાખ	સ્કે.કીટ. આલકની એરીયા ૪૮ સ્કે.કીટ. ઓમ શાંતી ગોલ્ડ પ્લસ્
બોગલીસ લક્ષ્ય ગણસો ખાવીસ કંક્ત)	નામે જાશીત જેનો કાઈનલ પ્લાટ નં.૧૫/૧ન-/આઈ સર્વે
Prospect No. 921341 Rs.2,79,845/-	નં.૪૭૯-બી, મોજે વટવા, ટી.પી.એસ. ૫૮, અમદાવાદ
(રૂપિયા બે લાખ અગણ્યા એસી હજાર આઠસો	૩૮૨૪૪૦, ગુજરાત, ભાત ખાતે આવેલી મિલકતના બધા જ
પીસ્તાલીસ કંક્ત)	ભાગો સહિત
R P (s.11,19,322/- (રૂપિયા અગીયાર લાખ હોગણીસ હજાર ત્રણસો બાવીસ ફક્ત) rospect No. 921341 Rs.2,79,845/- રૂપિયા બે લાખ અગણ્યા એંસી હજાર આઠસો

એસેટ્સ સામે કાર્યવાહી હાથ ધરશે અને લાગુ થતા નિયમો/સમગ્રપણે તે દેવાદારના જોખમે અને ભોગે રહેશે. વધુ માહિતી માટે અધિકૃત અધિકારી **દ્ભાંચ ઓફિસ**ઃ ઓફીસ નં.૭૦૧, સાતમો માળ, 21st સેન્ચ્યુરી બિઝનેસ સેન્ટર, ઉધના દરવાજા પાસે, રીંગ રોડ, સુરત ૩૯પ૦૦૨/ અથવા કોમર્સ હાઉસ. ચોથો માળ. કોમર્સ હાઉસ ૪. શેલ પેટોલ પંપની પાસે. આનંદનગર રોડ. પ્રહલાદનગર. અમદાવાદ ૩૮૦૦૫૧/અથવા **કોર્પોરેટ ઓફિંસ**ઃ આઇઆઇએફએલ ટાવર પ્લોટ નં.૯૮, ફેસ-૪, ઉંઘોગ વિહાર, ગુરગાંવ, હરીયાણા સંપર્ક કરવો. સહી/- અધિકૃત અધિકારી, IIFL હોમ ફાઇનાન્સ લીમીટે

<u>AMRAPALI INDUSTRIES LTD</u>

CIN: L17200GJ2014PLC078738

Unit No. PO5-02E, 5th Floor, Tower A WTC Gift City, Gandhinagar-382355 Contact No.+917926581329, E-mail ID: ail@amrapali.com, Website: www.amrapalispot.com

NOTICE OF THE 33rd ANNUAL GENERAL MEETING OF THE COMPANY AND E-VOTING

NOTICE is hereby given that in accordance with the Circular No. 20 dated May 5, 2020 read with Circular No. 14 dated April 8, 2020 and Circular No. 17 dated April 13, 2020and Circular no. 02/2021 dated January 13, 2021 in relation to "Clarification on holding of annual general meeting (AGM) through video conferencing (VC) or other audio visual means (OAVM)" (hereinafter collectively referred to as "MCA Circulars") issued by Ministry of Corporate Affairs ("MCA") for holding of Annual General Meeting through VC or OAVM, the Thirty Three(33rd) Annual General Meeting (AGM) of the Members of Amrapali Industries Limited be held on Tuesday, September 28, 2021 at 05:00P.M. at the registered of the Company situated at Unit No. PO5-02E, 5th Floor, Tower A WTC Gift City, Gandhinagar-382355 and through Video Conferencing ("VC") / Other Audio Visual Means ("OAVM") to transact the Ordinary Businesses and Special Businesses as set out in the notice of 33rd AGM.

In accordance with the General Circular No. 20/2020 dated May 5, 2020 read with General Circular No. 14/2020 dated April 8, 2020, General Circular No. 17/2020 dated April 13, 2020 and General Circular No. 02/2021 dated January 13,2021, issued by the Ministry of Corporate Affairs and Circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated May 12, 2020 and Circular No. SEBI/HO/CFD/CMD2/CIR/ P/2021/11 dated January 15, 2021 issued by the Securities Exchange Board of India (SEBI) the Notice of AGM along with Annual Report 2020-21 have been sent through electronic mode only to those Members whose email addresses are registered with the Company/ Depositories. Member may note that Notice and Annual Report 2020-21have been uploaded on the website of the Company at www.amrapalispot.com,website of BSE Limited at www.bseindia.com and website of National Securities Depository Limited (NSDL)i.e. www.evoting.nsdl.com. In light of the MCA Circulars, the shareholders whether holding equity shares in demat form or

physical form and who have not submitted their email addresses and in consequence to whom the notice of 33rd AGM and Annual Report 2020-21 could not be serviced, may temporarily get their e-mail addresses registered by following the procedure given below:

1. In case shares are held in physical mode, please provide Folio No., Name of shareholder, scanned copy of the share certificate (front and back), PAN (self-attested scanned copy of PAN card), AADHAR (self-attested scanned copy of Aadhar Card) by email to ail@amrapali.com

2 .In case shares are held in demat mode, please provide DPID-CLID (16 digit DPID + CLID or 16 digit beneficiary ID), Name, client master or copy of Consolidated Account statement, PAN (self-attested scanned copy of PAN card), AADHAR (self-attested scanned copy of Aadhar Card) to

3. Alternatively member may send an e-mail request to evoting@nsdl.co.in for obtaining User ID and Password by proving the details mentioned in Point (1) or (2) as the case may be.

Post successful registration of the e-mail address, the shareholder would get soft copies of notice of 33rd and Annual Report 2020-21 and the procedure for e-voting along with the user-id and the password to enable e-voting for 33rd AGM. In case of any queries, shareholder may write to the Company at ail@amrapali.com. Shareholders are requested to register/ update their Email Ids with their Depository Participant(s) with whom they maintain their demat accounts if shares are held in dematerialized mode by submitting the requisite documents.

There being physical shareholders in the Company, the Register of members and share transfer books of the Company will be closed from Wednesday, September 22, 2021 to Tuesday, September 28, 2021. Members whose names are recorded in the Register of Members or in the Register of Beneficial Owners maintained by the Depositories as on Tuesday, September 21, 2021 ("Cut-off date"), shall only be entitled to avail the facility of remote e-voting as well as e-voting on the Annual

Pursuant to the provisions of Section 108 of the Companies Act, 2013 read with Rules made thereunder (as amended) and Regulation 44 of SEBI (LODR) Regulations, 2015 (as amended) and above mentioned MCA Circulars, the Company is providing facility of remote e-voting and e-voting on the date of the AGM to its Members in respect of the businesses to be transacted at the AGM. For this purpose, the Company has entered into an agreement with NSDL for facilitating voting through

The remote e-voting will commence on 9:00 A.M. on Saturday, September 25, 2021 and will end on 5:00 P.M. on Monday, September 27, 2021. During this period, the members of the Company holding shares as on Cut-off date may cast their vote electronically (Remote E-Voting). Members may note that a) the remote e-voting module shall be disabled by NSDL after the aforesaid date and time for voting and once the vote on a resolution is cast by the member, the member shall not be allowed to change it subsequently; b) the facility of e-voting shall be made available at the 33rd AGM; and c) the members who have cast their vote by remote e-voting prior to the 33rd AGM may also attend the 33rd AGM but shall not be entitled to cast their vote again. Detailed procedure for remote e-voting/ evoting is provided in the Notice of the 33rdAnnual General Meeting.

Any person, who acquires shares of the Company and become member of the Company after dispatch of the Notice of AGM and holding shares as on the cut-off date i.e. Tuesday, September 21, 2021, are requested to refer to the Notice of AGM for the process to be adopted for obtaining the USER ID and Password for casting the vote.

In case of any queries for e-voting, you may refer the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-voting user manual for Shareholders available at the download section of www.evoting.nsdl.com or call on toll free no.: 1800-222-990 or send a request at evoting@nsdl.co.in.Members may also contact Ms. Ekta Jain, Company Secretary of the Company at the registered office of the Company or may write an e-mail to ail@amrapali.com or may call on +91-0288-2730088 for any further clarification.

Members can attend and participate in the Annual General Meeting at the registered office of the Company or through VC/OAVM facility. The instructions for joining the Annual General Meeting through VC/OAVM are provided in the Notice of the Annual General Meeting. In case the shareholders/members have any queries or issues regarding participation in the AGM, you can write an email to evoting@nsdl.co.in or Call us: - Tel: 1800-222-990. Members attending the meeting through VC/OAVM or physically attending at the Registered Office shall be counted for the purposes of reckoning the quorum under Section 103 of the Companies Act, 2013.

> For, AMRAPALI INDUSTRIES LTD YASHWANT AMRATLAL THAKKAR Chairman & Managing Director DIN: 00071126

Place: Ahmedabad Date: September 7, 2021

Place: Ahmedabad Date: 6th September, 2021 For, Indo Us Bio Tech Limited SD/- Jagdish Ajudia Chairman & Managing Director

તારીખ : ૦૬.૦૯.૨૦૨૧ સ્થળ : અમદાવાદ

સહી/- મોહિત ડી. દેસાઇ મેનેજીંગ ડીરેક્ટર DIN: 03089420